



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૪/૨૦૧૯ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૭૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૪ કેસ કરી, ૫૯ વ્યક્તિઓને ઝડપી, ૩૭૬ લીટર દેશી દારૂ, ૦૬ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૮૨,૪૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૭૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૪૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :

સમાચાર યાદી નં.૬૮૦/૧૯

વાડજ : પ્રિતેશભાઈ કુશલરાજ પારેખ (ઉ.વ.૪૦)(રહે,પ્લોટ નંબર ૫૯ સેક્ટર-૪ ગાંધીધામ કચ્છ) એ તા.૧૭/૦૪/૨૦૧૯ ના રોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૩/૧૪ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન ઉસ્માનપુરા એચ.વી.જીરાવાલા હાઉસ ખાતે આરોપી અંજુલ જ્ઞાનેંદ્ર ગૌતમ (રહે. સ્વસ્તિક એપાર્ટ બેકરી સીટી વેજલપુર) એ પ્રિતેશભાઈ ની કંપનીમાં નોકરી દરમ્યાન કંપનીના ગ્રાહક ને કંપની તરફથી જે કમીશન આપવામાં આવે છે તે કમીશનમાં ખોટી રીતે વધારો કરી, તેમાંથી અમુક ટકા રકમ મેળવી લઈ, કંપનીનો ખાનગી ડેટા ચોરી તે ડેટા પ્રિતેશભાઈની હરીફ કંપની “બ્રાઇટ પેકેજીંગ કેવે એન્ટર પ્રાઇસ” ને પોતાના અંગત ફાયદા સારૂ વેચી ગુનાહિત લાભ મેળવી તે રકમ પોતાના ખાતા તથા તેમની પત્નીના ખાતા તેમજ પોતાના અંગત મિત્ર વર્તુળના ખાતામાં જમા કરાવી છેલ્લા છ વર્ષ દરમ્યાન અંદાજે ૧,૫૦,૦૦,૦૦૦/- રૂપિયા મેળવી લઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.પી.પરમાર ચલાવે છે.

ધરફોડ :

સમાચાર યાદી નં.૬૮૧/૧૯

શહેરકોટડા : મોહમદઅહેસાન અબ્દુલગની મેમણ (ઉ.વ.૪૦)(રહે.કસ્તુરભાઈ બ્લોક, ચામુંડા ચાર રસ્તા, નરોડા રોડ) એ તા.૧૭/૦૪/૨૦૧૯ ના રોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૦૪/૨૦૧૯ રાતના ૯/૦૦ થી તા.૧૭/૦૪/૨૦૧૯ ના ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન નરોડા રોડ મારુતી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલ “પ્રથમ એન્ટરપ્રાઇઝ” નામના ગોડાઉનની ઓફિસમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, ડ્રોઅરનું લોક તોડી, રોકડ રૂપિયા ૫૧,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.એલ.જેબલીયા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૬૮૨/૧૯

માધવપુરા : શકુન્તલાબહેન W/o વક્તાવરમલજી જૈન (ઉ.વ.૪૮)(રહે.દર્શનપ્રાઈડ, તારદેવ માજીસાગર હોટલ પાસે, એ.સી. માર્કેટ, આર.ટી.ઓ. મુંબઈ શહેર) એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૪/૧૯ ના કલાક ૦૫/૪૫ વાગ્યાના સુમારે નમસ્તે સર્કલ હઠીસીંગની વાડી પાસે આવેલ AMTS બસ સ્ટેન્ડ પાસે રોડ પર ઉભા હતા દરમ્યાન એક્ટીવા ચલાવી આવેલ પુરૂષ શકુન્તલાબહેનની નજર ચુકવી તેમના હાથમાંથી હેંડ પર્સ કે જેમાં સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-, રેડ મી-૬ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૭૦૦૦/- તથા રોકડ રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૨,૦૦૦/- મતા મુકેલ પર્સની ચોરી કરી લઈ ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

ટ્રેઇનની અડફેટે આવી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૬૮૩/૧૯

વટવા : લગ્ધીરસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.૩૦) (રહે.શક્તિ ગાર્ડનિયા ગામડી રોડ વટવા) તા.૧૭/૪/૧૯ રાતના ૮/૪૫ વાગ્યાના સુમારે રોપડા બ્રીજ નીચે ટ્રેઇનની અડફેટે આવી જતાં તેમનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એમ.દેસાઇ ચલાવે છે.

મણીનગર : ગણેશભાઈ ભવાનભાઈ વાઘેલા (ઉ.વ.૭૦)(રહે.ચોર્યાસીની ચાલી, ગીતા મંદીર) તા.૧૭/૪/૧૯ ના કલાક ૧/૪૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે મણીનગર રેલ્વે ક્રોસીંગ ખાતે પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે મણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ટી.એન.મોરડીયા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૬૮૪/૧૯

કૃષ્ણનગર : વેદાંત કુમનભાઈ ડોબરીયા (રહે.પુલીનપાર્ક ઠક્કરનગર) એ અગમ્ય કારણસર તા.૧૭/૪/૧૯ બપોરના ૨/૫૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એસ.સાકરીયા ચલાવે છે.

વટવા : મહેશભાઈ રામચન્દ્ર બાવડા (રહે.અંબિકા એપાર્ટમેન્ટ શહેરી ગરીબ આવાસ યોજના ન્યુ ઘોડાસર વટવા) એ અગમ્ય કારણસર તા.૧૭/૪/૧૯ સવારના ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી મહેશભાઈ કાશીરામભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.